

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧

-; અખબારી યાદી :-

પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત

રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટિ ટ્રસ્ટ -
ચિત્રનગરી દ્વારા નિમિતે ૩૧ કલાક સળંગ નોન સ્ટોપ કરાઓકે
આધારિત ગીત સંગીતનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ

તા. ૧૯-૧-૨૦૨૦



રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટિ ટ્રસ્ટ -ચિત્રનગરી દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ૩૧ કલાક સળંગ નોન સ્ટોપ કરાઓકે આધારિત ગીત સંગીત નો કાર્યક્રમ "સૂરોકી સલામી" સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે. આ કાર્યક્રમ તા.૧૮/૦૧/૨૦૨૦ સાંજે ૬:૦૦ કલાક થી તા.૧૯/૦૧/૨૦૨૦ રાત્રિ ના ૧ વાગ્યા સુધી ચાલ્યો હતો.

તા.૧૮/૦૧/૨૦૨૦ સાંજે ૬:૦૦ વાગ્યે આ કાર્યક્રમ નું ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના માન. ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી આશિષભાઈ વાગડિયા, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, મિશન સ્માર્ટ સિટિ ટ્રસ્ટ -ચિત્રનગરીના શ્રી જીતુભાઈ ગોટેયા, શ્રી મીનલબેન સોનપાલ, ડેપ્યુટી કમિશ્નર શ્રી એ.કે.સિંઘ, સિટી એન્જિનિયર શ્રી કે. એસ. ગોહેલ, આસી. કમિશ્નર શ્રી એચ. આર. પટેલ, ડો. રાજેશ તૈલી, આસી. મેનેજર શ્રી અમિત ચોલેરા, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ અવસરે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના માન. ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરીએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં એમ કહ્યું હતું કે, રાજ્ય સરકારશ્રી દ્વારા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ ખાતે યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમોમાં નોનસ્ટોપ સળંગ ૩૧ કલાક સુધી કરાઓકે આધારિત ગીતસંગીતના કાર્યક્રમના આયોજન બદલ રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટિ ટ્રસ્ટ -ચિત્રનગરી અભિનંદનના હક્કદાર છે. રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ થઈ રહેલી આ ઉજવણી અનુસંધાને રાજકોટ શહેર અને જિલ્લામાં રૂ. ૧૧૦૦ કરોડથી વધુના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે.

આ પ્રસંગે મ્યુનિ. કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટિ ટ્રસ્ટ -ચિત્રનગરી દ્વારા આયોજિત કરાઓકે આધારિત નોનસ્ટોપ ૩૧ કલાકનો ગીતસંગીતનો આ કાર્યક્રમ કાંઈક અનોખો છે. જેમાં સમાજના વિવિધ વર્ગના સંગીત ચાહકો ભાગ લઈ દેશભક્તિ અને અન્ય ગીતો રજુ કરી એકતાની અનુભૂતિ કરાવી રહ્યા છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ સામાજિક એકતા વધુ મજબુત બનાવવાનો છે. કરાઓકે સંગીતનું

સૌથી કઠીન ફોર્મ છે, જેમાં ગાયકે એકએક સૂર અને તાલ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે અને ત્યારે જ તેમાં પરફેક્શન આવે છે. જાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સગર્ભા બહેનો માટે "ગર્ભ સંસ્કાર"નો એક સાન અનોખો કાર્યક્રમ પણ યોજાયો છે. આ ઉપરાંત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થનાર છે.

સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી આશિષભાઈ વાગડિયાએ એમ કહ્યું હતું કે, આ કરાઓકે પ્રોગ્રામનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા માટે ગૌરવની વાત છે. રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી આપી તે બદલ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યક્ત કરીએ છીએ.

ડેપ્યુટી કમિશ્નર શ્રી એ.કે.સિંઘ અને આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જયમિનભાઈ ઠાકર દ્વારા પણ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એડીશનલ કલેક્ટર શ્રી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત હતા.

આ ૩૧ કલાક ના કાર્યક્રમ માં સૌથી કઠિન સમય રાત્રિ ૨ થી સવાર ના ૬ સુધી ચિત્રનગરીના શિવમ અગ્રવાલ તથા એના ગ્રૂપ દ્વારા સફળતા પૂર્વક પૂરો કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં રિક્ષાવાળા , શાકભાજીના ફેરિયા સહિત રાજકોટના અગ્રણીય ડોક્ટર્સ , ઉધ્યોગપતિ, એડવોકેટ, વેપારીઓ તથા નોનપ્રોફેશનલ ગાયકોએ ભાગ લીધેલ હતો. આ પ્રોગ્રામને સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપરાંત મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના સર્વશ્રી રશેષભાઈ વ્યાસ, સુરેશભાઈ રાવલ, જયશ્રીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ , શિવમ અગ્રવાલ , મૌલિક ગોટેયા , મુકેશભાઈ વ્યાસ , હેમાબેન વ્યાસ , શ્રેયસભાઈ તન્ના , ગૌરવ ખીરૈયા , હાર્દિક તન્ના , હરદેવસિંહ વાઘેલા , ફેની સૂચક , અખિલેશ, પરેશભાઈ ધોરાજીયા, ચંદ્રકાંતભાઈ ગોલવાળા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(જનસંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા

